



ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ
છઠ્ઠો માળ, ગિફ્ટ વન, માર્ગ: પ-સી, ઝોન-પ, ગિફ્ટ સીટી, ગાંધીનગર-૩૮૨ ૩૫૫.

ફોન નં.: (૦) ૦૭૯-૨૩૬૦૨૦૦૦, (૫) ૦૭૯-૨૩૬૦૨૦૫૪/૫૫

ઈ-મેલ- gerc@gercin.org, વેબસાઇટ: www.gercin.org

જાહેર સુનાવણી માટે ની નોટિસ

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે રાજ્યની વીજ કંપનીઓ દ્વારા જી.ઈ.આર.સી (બહુવર્ષીય પ્રશુલ્ક) વિનિયમો, ૨૦૧૬, અનુસંધાને નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ નું ટુ-અપ, નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના ARR ની મંજૂરી અને નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ પ્રશુલ્ક નિર્ધારણ માટે, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લીમીટેડ [GSECL] (૨૦૨૫/૨૦૨૧), ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ [GETCO] (૨૦૨૬/૨૦૨૧), સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર [SLDC] (૨૦૨૭/૨૦૨૧), દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ [DGVCL] (૨૦૨૮/૨૦૨૧), મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ [MGVCL] (૨૦૩૦/૨૦૨૧), પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ [PGVCL] (૨૦૩૧/૨૦૨૧), ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ [UGVCL] (૨૦૨૮/૨૦૨૧), ટોરેન્ટ પાવર લીમીટેડ- જનરેશન [TPL-G] (૨૦૩૨/૨૦૨૧), ટોરેન્ટ પાવર લીમીટેડ-ડીસ્ટ્રિબ્યુશન (અમદાવાદ) [TPL-D(A)] (૨૦૩૩/૨૦૨૧), ટોરેન્ટ પાવર લીમીટેડ-ડીસ્ટ્રિબ્યુશન (સુરત) TPL-D (S) (૨૦૩૪/૨૦૨૧) અને ટોરેન્ટ પાવર લીમીટેડ- ડીસ્ટ્રિબ્યુશન (દહેજ) TPL-D(D) (૨૦૩૫/૨૦૨૧) દ્વારા દાખલ કરવા આવેલ અરજીઓ પર જાહેર સુનાવણી હાથ ધરવાનું નક્કી કરેલ છે. વીજ કંપનીઓ દ્વારા ઉપરોક્ત અરજીઓ સાથે રસધરાવનાર વ્યક્તિ પાસેથી પોતાના વાંધા/સૂચનો રજૂ કરવા માટેની જાહેર નોટિસ સમાચાર પત્રોમાં આપવામાં આવેલ છે. ઉપરોક્ત અરજીઓની નોંધણી થયા પછી વીજકંપનીઓ દ્વારા જે વધારાની વિગતો આયોગ સમક્ષ રજૂ કરવામાં આવેલ છે, તેને આયોગની તેમજ વીજ કંપનીઓની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જાહેર સુનાવણી અત્રે દર્શાવેલ સમયસૂચી અનુસાર હાથ ધરવામાં આવશે.

વીજ કંપનીઓના નામ	જાહેર સુનાવણીની તારીખ અને સામાય
TPL-G, TPL-D (A), TPL-D (S), TPL-D(D)	૧૫.૦૨.૨૦૨૨ @ ૧૧:૩૦ AM
GSECL	૧૬.૦૨.૨૦૨૨ @ ૧૧:૩૦ AM
GETCO & SLDC	૧૬.૦૨.૨૦૨૨ @ ૩:૦૦ PM
DGVCL, MGVCL, PGVCL & UGVCL	૧૭.૦૨.૨૦૨૨ @ ૧૧:૩૦ AM

તદઉપરાંત નામદાર આયોગે જાહેર સુનાવણી વિડિઓ કોન્ફરન્સિંગ (MS Teams) દ્વારા રાખવાનો નિર્ણય કરેલ છે. યુટીલીટી ના પ્રતિનિધિઓ તથા રસ ધરાવનાર વ્યક્તિઓ કે જેઓએ તેમના સૂચનો/વાંધાઓ/ટિપ્પણીઓ રજૂ કરેલ છે, તેઓ સુનાવણીની કાર્યવાહીમાં વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લઈ શકશે. વધુમાં, રસ ધરાવનાર વ્યક્તિઓ કે જેઓ નામદાર આયોગ સમક્ષ વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા જાહેર સુનાવણીમાં નિવેદન કરવા માંગે છે તેઓએ તેમના નામ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલની માહિતી તા. ૧૨.૦૨.૨૦૨૨ સુધીમાં efiling@gercin.org પર ઇ-મેઇલ કરીને મોકલી આપવા વિનંતી છે. વધુમાં, રસધરાવનાર વ્યક્તિઓ કે જેમની પાસે ઓડિયો-વિઝ્યુઅલ સુવિધા નથી તેઓ આયોગની કચેરી, ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ રીતે નામદાર આયોગ સમક્ષ રજૂઆત કરી શકશે.

ગાંધીનગર

તા.: ૦૪/૦૨/૨૦૨૨

- સહિ -

સચિવ, જીઈઆરસી